

વરાછા પો.સ્ટે. વિસ્તારમાં આંગડીયા પેઢીના કર્મચારીને ઘાતક હથિયારો બતાવી લુંટ-ઘાડ કરનાર રાજસ્થાની ગેંગને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં આગામી રથયાત્રા નિમિત્તે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા શરીર સબંધી અને મિલકત સબંધી ગુના કરતા ઇસમોની પ્રવૃત્તિ પર વોચ રાખવા ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમો વર્ક આઉટમાં જોડાયેલ તે દરમ્યાન ક્રાઇમ બ્રાંચના પો.સ.ઇ.વી.જે.ચાવડા નાઓના સ્કોડના અ.હે.કો. જયેશભાઈ ગંગાધરભાઈ અને અ.હે.કો. દિપકભાઈ લોટનભાઈ બાતમી આધારે, પટેલ સોમાભાઈ રામદાસ તથા પટેલ અમરતભાઈ માધાભાઈ આંગડીયા પેઢીના કર્મચારીઓ ભાવનગર ખાતેથી ટ્રાવેલ્સમાં હિરા તથા રોકડા રૂપિયા લઇએ વહેલી સવારે સુરત આવે છે. જેઓ વરાછા મીનીબજાર ખાતે ઉતરી બોલેરો જીપ રજી.નં. GJ-5-JP-7159 માં બેસી મહિધરપુરા ભવાનીવડ ખાતે જતા તે દરમ્યાન આ કર્મચારીઓને ઉભા રાખી ચાકુ બતાવીને મર્યાની ભુકી નાંખી, લુંટ કરી આંગડીયા પેઢીની બોલેરો કાર લઇ ત્યાંથી ભાગી જવાની યોજના બનાવી વરાછા મીની બજાર પાસે આરોપીઓ ભેગા થવાના છે. જે બાતમી આધારે તા.૦૪/૦૭/૨૦૧૯ ના રોજ વહેલી સવારે વરાછા મીની બજાર બ્રીજ નીચેથી આરોપીઓને (૧)છરા નંગ-૩ કિ.રૂ.૩૦૦/- (૨) એક લોખંડનુ ગણેશીયુ કિ.રૂ.૧૦૦/- (૩)દોરી કિ.રૂ.૧૦૦ (૪) સેલોટેપ રોલ નંગ-૧ કિ.રૂ.૫૦/- (૫) મર્યાની ભુકી કિ.રૂ.૫૦/- (૬) અલગ અલગ મો.ફોન નંગ-૧૭ કિ.રૂ.૨૮૫૦૦/- (૭) કાળા કલરની બેગ કિ.રૂ.૧૦૦/- મળી કુલ કિ.રૂ.૨૯૨૦૦/- મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓની ધરપકડ કરી ડી.સી.બી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૯,૪૦૨,૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ આરોપી (૧) દિપારામ ઉર્ફે દિપક જગારામ માલી ઉ.વ.૨૬ રહે. કમલેશ મારવાડીના મકાનમાં લક્ષ્મીનગર સોસાયટી, નારાયણ નગરની પાસે કાલીપુલ,પુણાગામ, સુરત મુળ રહે. ગામ ધાનસા થાના-રામસીન તા. ભીનમાલ જી. ઝાલોર રાજસ્થાન (૨) શ્રવણકુમાર ફાવડારામ પુરોહિત ઉ.વ. ૨૫ હાલ રહે. એજન મુળ રહે. ગામ રાયપુરીયા થાના-બાગરા તા.જી. ઝાલોર રાજસ્થાન (૩) કમલેશ પુરાજી પુરોહિત ઉ.વ. ૨૧ હાલ રહે. એજન મુળ રહે. ગામ તતતળા થાના. જાંબ તા. સાંચોર જી. ઝાલોર રાજસ્થાન (૪) કમલકિશોર ઉકારામ મેઘવાળ ઉ.વ. ૩૦ રહે. એજન મુળ રહે. રાખી તા. બાલોતરા જી. બાડમેર, રાજસ્થાન (૫) ખીમસીંહ મુલસીંહ રાણારાજપુત ઉ.વ. ૨૩ હાલ રહે. એજન મુળ રહે. ગામ મીઠડી, થાના. નૌસરા તા. આહુર જી. ઝાલોર, રાજસ્થાન (૬) ચમન વાહજીભાઈ પટેલ ઉ.વ. ૪૩ રહે. માઝૂતી પંચવટી એપાર્ટમેન્ટ ઉમીયા માતાના મંદિર પાસે પહેલા માળે વરાછા, સુરત મુળગામ, ચંદમાણા તા.જી. પાટણ મજકુર આરોપીઓની પુછપરછ કરતા મજકુર આરોપીઓ પૈકી ચમન વાહજીભાઈ પટેલનાનો બે માસ પહેલા પટેલ સોમાભાઈ રામદાસ નામની આંગડીયા પેઢીમાં કામ કરતો અને ભાવનગરથી પેઢીના રોકડ રૂપિયા હિરા વગેરે લઇ ટ્રાવેલ્સ બસમાં ભાવનગરથી સુરત ખાતે આવતો હતો. તેની સાથે પટેલ અમરતભાઈ માધાભાઈના આંગડીયા પેઢીના કર્મચારી પણ આવતા બંને સુરત ખાતે વરાછા મીનીબજાર ખાતે ઉતરી બોલેરો રજી. નં. GJ-5-JP-7159 માં બેસી મહિધરપુરા ભવાનીવડ ખાતે પોતાના આંગડીયા પેઢીમાં જતા એક માસ પહેલા મજકુરે આંગડીયા પેઢીમાંથી નોકરી છોડી દીધેલ અને સુરત ખાતે રહેવા આવી ગયેલ. દરમ્યાન તેની પુરષોત્તમ મારવાડી મારફતે મુલાકાત દિપારામ ઉર્ફે દિપક જગારામ માલી સાથે થયેલ અને દિપારામે તેણે કોઇ પેઢીમાં રોકડા રૂપિયા તથા હિરા વગેરે લઇ આવતા હોય તો બતાવવા જણાવેલ. ચમનને રૂપિયાની જરૂર હોઇ તેને ઉપરોક્ત બંને પેઢીના કર્મચારીઓ સવારે રૂપિયા તથા હિરા લઇ ભાવનગરથી સુરત ટ્રાવેલ્સમાં આવે છે અને મીની બજાર ખાતે ઉતરી બોલેરો જીપમાં બેસી પોતાની પેઢીમાં જતા છે તે મુજબની માહિતી ગાડી નંબર સાથે આપેલ. જેથી દિપારામે રાજસ્થાનથી તેના સાથી સાગરીતો બોલાવેલ અને ભાડેથી રૂમ રાખી રહેવા લાગેલ. ત્યારબાદ તમામ આરોપીઓ બે વાર જગ્યાની રેકી પણ કરી આવેલ. અને આજરોજ હથિયારો બતાવી લુંટ કરવાના ઇરાદે વરાછા મીની બજાર બ્રીજ નીચે ભેગા થયેલ અને લુંટ કરી આંગડીયા પેઢીની બોલેરો ગાડી લઇ ત્યાંથી રાજસ્થાન ભાગી જવાની હકીકત જણાવેલ છે.

આરોપી ગુનાનો ઇતિહાસ:- આરોપી - દિપારામ ઉર્ફે દિપક જગારામ માલી તથા શ્રવણકુમાર ફાવડારામ પુરોહિત નાઓએ (૧) મુંબઇ ઘોબીતળાવ વિસ્તારમાં રોકડા રૂપિયા ૭૫ લાખની લુંટ કરેલ જે કામે મુંબઇ આઝાદ મેદાન પો.સ્ટે. ગુ.ર.નં.૩૩૦/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૯૫,૩૯૭,૩૪૨,૪૫૨,૧૨૦ બી મુજબના ગુનામાં પકડાઇ ચુકેલ છે. જે ગુનામાં તેઓ આર્થર રોડ જેલમાં રહી જામીન પર છુટેલ છે. (૨) બનાસકાંઠા જીલ્લાના પાથવાડા પો.સ્ટે. ગુ.ર.નં.૪૧/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ મુજબના ઘાડના ગુનામાં પકડાઇ ચુકેલ છે. (૩) તામીલનાડુ રાજ્યના સુરામંગલમ પો.સ્ટે.મા ગુ.ર.નં.૧૦૬૪/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૫૭,૫૧૧ મુજબના ધરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલ છે. આરોપી કમલેશ પુરોહિત- (૧) મુંબઇ સેન્ટ્રલ સીટી મોલમાં દસ લાખની લુંટના ગુનામાં પકડાઇ ચુકેલ છે.